



## ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ

પરિપત્ર : -

વિષય: ખેલ મહાકુલ-૨૦૧૮ના શાળા / ઝોન, મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાના આયોજન-સંચાલન બાબત  
સંદર્ભ: ૧) જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના પત્ર ક્રમાંક:જિ.ર.ગ.અ./૩૩૭૪થી ૩૩૭૩/૧૮  
તા.૨૧/૦૮/૨૦૧૮

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ અને પી.જી.સેન્ટરના વડાઓને તેમજ ભવનનોના અધ્યક્ષશ્રીઓને ઉપર્યુક્ત વિષય તથા સંદર્ભ પરત્વે જણાવવામાં આવે છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા ખેલ મહાકુલ ૨૦૧૮નું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુલ-૨૦૧૮ના અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું શાળા/ઝોન, મહાનગરપાલિકા કક્ષાએ આયોજન સંદર્ભ પત્રમાં દર્શાવેલ વિગતે કરવામાં આવેલ છે, તો આ અંગેની આપની કોલેજમાંથી ખેલ મહાકુલ-૨૦૧૮માં ભાગ લેનાર ખેલાડીઓને માહિતગાર કરવા જણાવવામાં આવે છે.

I/C કુલસચિવ

બિડાણ:સંદર્ભ પત્ર

નં. : બીકેએનએમયુ/૨૭/૩૮૭/૨૦૧૮-૧૯

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

સરકારી પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડીયા, જૂનાગઢ.

તા.૨૮/૦૮/૨૦૧૮

પ્રતિ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના આચાર્યશ્રી/ સંચાલકશ્રીઓ/ યુનિવર્સિટી ભવનનોના અધ્યક્ષશ્રીઓ તરફ...

નકલ સાદર રવાના :-

૧. માન. કુલપતિશ્રીના અંગત સચિવશ્રી તરફ...

૨. જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, બ્લોક નં. ૧/૧, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ.

નકલ સાદર રવાના જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે

૧. કો-ઓર્ડિનેટરશ્રી, ફીઝીકલ એજ્યુકેશન સેલ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ.

૨. આઈ.ટી. સેલ(વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા અર્થે)

DSO- મો. ૯૭૩૭૧ ૬૩૩૧૧

APO- મો. ૮૨૦૦૪ ૯૧૪૪૫

મો. ૭૮૭૮૯ ૭૭૦૭૦

ફોન: ૦૨૮૫ - ૨૬૩૦૪૯૦

પ્રતિ,

૧. પ્રાંત અધિકારીશ્રી, તમામ જુનાગઢ જિલ્લો
૨. તાલુકા વિકાસ અધિકારીશ્રી, તમામ જુનાગઢ જિલ્લો
૩. મામલતદારશ્રી, જુનાગઢ જિલ્લો તમામ
૪. શૈક્ષણિક સંસ્થાઓના પ્રિન્સીપાલશ્રીઓ
૫. રમતગમત મંડળોના વડાશ્રીઓ, જુનાગઢ
૬. ઝોન/જિલ્લા રમત આયોજક કન્વીનરશ્રીઓ તમામ
૭. સીનિયર સીટીઝન મંડળના મંત્રીશ્રી

ક્રમાંક: જિ.ર.ગ.અ. / ૩૩૭૪ થી ૩૭૭૩/૧૮

જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,

બ્લોક નં. ૧/૧, બહુમાળી ભવન,

સરદારભાગ, જુનાગઢ.

તા. ૨૧/૦૮/૨૦૧૮

## વિષય : ખેલ મહાકુંભના શાળા / ઝોન, મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાના આયોજન

- સંચાલન બાબત - ૨૦૧૮

ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભના નવમાં વર્ષમાં મંગલપ્રવેશની સાથે ખેલ મહાકુંભને મળેલ અનોખી સફળતાને ધ્યાનમાં રાખી સરકારશ્રીએ રમતક્ષેત્રે બહોળો પ્રચાર-પ્રસાર થાય અને ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે હેતુથી સને ૨૦૧૮ માં પદ્મ આ સ્પર્ધા ચાલુ રાખી છે. દરેક શાળાએ શાળાકક્ષાએ યોજાનાર સ્પર્ધાના પ્રથમ દિવસને 'સ્પોર્ટ્સ ડે' તરીકે ઉજવવાનો રહેશે.

આ ખેલ મહાકુંભમાં ગત વર્ષે મળેલ સફળતાને ધ્યાને રાખી ચાલુ વર્ષે રાજ્યકક્ષાએ કુલ ૩૪ રમતોનું તેમજ જિલ્લાકક્ષાએ કુલ ૨૫ રમતોનું આયોજન હાથ ધરેલ છે. જેમાં

(A) શાળા / વોર્ડ કક્ષાએ પાંચ રમતો ૧) કબડ્ડી ૨) એથ્લેટીક્સ ૩) વોલીબોલ ૪) ખોખો ૫) રસ્સાખેંચ નું આયોજન હાથ ધરવામાં આવશે.

(B) ઝોન કક્ષાએ આઠ (૮) રમતોનું આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં ઉપરની પાંચ રમતોમાં વિજેતા થનાર ઝોન કક્ષાએ રમવા આવશે, ઉપરાંત ઝોન કક્ષાએ સીધી યોગાસન, શુટીંગ બોલ, ચેસ, [એથ્લેટીક્સ (અન્ય ઈવેન્ટ)] સ્પર્ધા યોજવામાં આવશે.


(C) જ્યારે સીધી જિલ્લાકક્ષાએ ૧૩ (તેર) રમતોનું આયોજન હાથ ધરવામાં આવશે. જ્યારે ઉપરની આઠ રમતોમાં જે વિજેતા થશે તેઓ જિલ્લા કક્ષાએ રમવા આવશે. ૧) તીરંદાજી ૨) બેડમિન્ટન ૩) બાસ્કેટ બોલ ૪) સ્વીમીંગ ૫) ફૂટબોલ ૬) જૂડો ૭) સ્કેટીંગ ૮) ટેબલ ટેનીસ ૯) હોકી ૧૦) કુસ્તી ૧૧) હેન્ડબોલ ૧૨) લોન ટેનીસ ૧૩) ટેકવેન્ડો


ઉપરોક્ત સ્પર્ધાઓના આયોજન/સંચાલનમાં સહયોગ આપવા અને જિલ્લા રમતગમત અધિકારી/જિલ્લા, તાલુકા રમત કન્વીનર દ્વારા કોઈ અધિકારી/કર્મચારીઓની સેવા લેવામાં આવે ત્યારે તેમને ફરજ પર ગણી મુક્ત કરવાના રહેશે.


સ્પર્ધાના રાજ્ય સરકારશ્રીએ કરી આપેલ નિયમો તથા શાળા, ઝોન કક્ષા, મહાનગરપાલિકા કક્ષાના કન્વીનરોની માહિતી અલગ-અલગ પત્રકોમાં દર્શાવેલ છે. બહોળી સંખ્યામાં પ્રચાર-પ્રસાર કરી ભાગ લેવા અનુરોધ છે.

નોંધ : ૧) ઝોન/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં તમામ વયજૂથના ખેલાડીઓએ જન્મ તારીખ દર્શાવતં બોનાફાઈડ સર્ટી/આધારકાર્ડ સાથે આયોજક ઝોન/જિલ્લા કક્ષાના કન્વીનરને ફરજિયાત આપવાના રહેશે.

૨) ઓનલાઈન કરેલ પ્રિન્ટ જે તે સ્પર્ધા સ્થળે આપવાની ફરજિયાત રહેશે. અન્યથા ભાગ લેવા દેવામાં આવશે નહિ. જેની જવાબદારી ખેલાડી/સંસ્થાની રહેશે.

  
(વિશાસવી. દિહોરા)  
જિલ્લા રમત ગમત અધિકારી  
જુનાગઢ શહેર

  
(કે. એ. પટેલ)  
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  
જુનાગઢ

  
(મો. એસ. ડેસા)  
જિલ્લા શિક્ષણાધિકારી  
જુનાગઢ

નકલ સવિનય રવાના :-

- \* સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર.
- \* ડાયરેક્ટર જનરલશ્રી, એસ. એ. જી., ગાંધીનગર.
- \* કમિશ્નરશ્રી, યુ.સે. અને સાં. પ્ર., ગાંધીનગર.
- \* કલેક્ટરશ્રી, જુનાગઢ.
- \* જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જુનાગઢ.
- \* જિલ્લા પોલીસ અધિકારીશ્રી, જુનાગઢ.
- \* વાઈસ ચાન્સેલરશ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ., જુનાગઢ.
- \* વાઈસ ચાન્સેલરશ્રી, કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ.
- \* સચિવશ્રી, એસ. એ. જી. ગાંધીનગર.
- \* ખાસ ફરજ પરના અધિકારીશ્રી, યુ.સે. અને સાં. પ્ર., ગાંધીનગર.
- \* યુથ બોર્ડ અધિકારીશ્રી, યુ.સે. અને સાં. પ્ર., ગાંધીનગર.
- \* સચિવશ્રી, રાજ્ય રમતગમત પરિષદ, ગાંધીનગર.

- \* માન. સંસદ સભ્યશ્રી, જુનાગઢ તમામ
- \* પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, જુનાગઢ.
- \* માન. ધારાસભ્યશ્રી, જુનાગઢ તમામ
- \* નાયબ માહિતી નિયામકશ્રી, જુનાગઢ.  
(વિનામૂલ્યે બહોળી પ્રસિદ્ધિ અર્થે)
- \* ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા, તમામ
- \* જિલ્લા યુવા વિકાસ અધિકારી, તમામ, ગુજરાત રાજ્ય.
- \* જિલ્લા રમતગમત અધિકારી, તમામ, ગુજરાત રાજ્ય.
- \* આચાર્યશ્રી, જે તે રમતના તાલુકાકક્ષા/જિલ્લાકક્ષા સ્પર્ધાના આયોજન સંચાલન અર્થે વ્યવસ્થા કરવા સારું.
- \* સદસ્યશ્રી તમામ, જિલ્લા પંચાયત, જુનાગઢ જિલ્લો
- \* અમલીકરણ સમિતિના સભ્યશ્રીઓ તાલુકા/જિલ્લા તમામ

## ખેલ મહાકુંભ સ્પર્ધાના સામાન્ય નિયમો - ૨૦૧૮

ખેલ મહાકુંભનો મુખ્ય હિતેશ

- 1) Development of Sport's Environment - ખેલકુદ વાતાવરણ નિર્માણ કરવું  
2) Health Consious - સ્વાસ્થ્ય અંગે જાગૃતિ 3) Talent Search - પ્રતિભા શોધ

- (૧) ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ / નોકરી / વ્યવસાય / નિવાસ કરતો હોવા જોઈએ. જેના આધાર-પુરાવા-પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. (નોકરીયાતના કિસ્સામાં નિયમ-૧૭ લાગુ પાડવામાં આવશે.)
- (૨) સ્પર્ધાનીચે મુજબની વય મર્યાદામાં યોજવામાં આવશે. (A) ૯ વર્ષથી નીચે (B) ૧૧ વર્ષથી નીચે (C) ૧૪ વર્ષથી નીચે (D) ૧૭ વર્ષથી નીચે (E) ઓપન એઈજ (સિનિયર) ગ્રૂપ (F) ૪૦ વર્ષથી ઉપરના, (G) ૬૦ વર્ષથી ઉપરના
- (૩) સ્પર્ધા જે તે રમતના ભારતના ફેડરેશન/એસોસીએશનના નિયમ મુજબ જ યોજવામાં આવશે.
- (૪) કોઈ પણ ખેલાડી તેની ખરેખર (ચેલેન્જ સિવાય) એક જ વયમર્યાદા (ગ્રૂપ) / વજનગ્રૂપમાં જ ભાગ લઈ શકશે.  
૧) અં. ૯, અં. ૧૧, અં. ૧૪, અં. ૧૭ વયજૂથના ખેલાડી તેનાથી ઉપરની વયજૂથમાં ભાગ લઈ શકશે. (કોઈ પણ એક જ વયજૂથ (ચેલેન્જ માટે)  
૨) ઓપન એઈજ ગ્રૂપ (સિનિયર) ના ખેલાડીઓ પોતાની વયજૂથમાં જ ભાગ લઈ શકશે.  
૩) ૪૦ વર્ષથી ઉપરની વયજૂથના ખેલાડીઓ માત્ર તેમની વયજૂથમાં જ ભાગ લઈ શકશે.  
૪) ૬૦ વર્ષથી ઉપરની વયજૂથના ખેલાડીઓ પોતાના વયજૂથ અથવા ૪૦ વર્ષથી ઉપરની વયજૂથની રમતોમાં ભાગ લઈ શકશે. (કોઈ પણ એક જ વયજૂથ (ચેલેન્જ માટે)
- (૫) એથ્લીટીક્સ રમતમાં વધુમાં વધુ બે વ્યક્તિગત અને એક રીલે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે (SGFI ના નિયમ મુજબ). એથ્લીટીક્સ :- જિલ્લાકક્ષાની સ્પર્ધામાં યોજાનાર વ્યક્તિગત ઈવેન્ટમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ખેલાડીઓને ૪×૧૦૦ મી. રીલે અને ૪×૪૦૦ મી. રીલેની એથ્લીટીક ટીમ બનાવવાની રહેશે જે રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.  
- સ્વીમિંગ રમતમાં વધુમાં વધુ ત્રણ ઈવેન્ટ અને બે રીલે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. સ્વીમિંગ :- જિલ્લાકક્ષાની સ્પર્ધામાં યોજાનાર વ્યક્તિગત ઈવેન્ટમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ખેલાડીઓને ૪×૧૦૦ મી. ફ્રી સ્ટાઈલ રીલે અને ૪×૧૦૦ મી. મીડલે, ૪×૪૦૦ ફ્રી સ્ટાઈલ રીલે ટીમ બનાવવાની રહેશે જે રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
- (૬) સ્કેટીંગમાં વધુમાં વધુ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. તેમજ ઓપન એઈજ / ૪૦ વર્ષથી ઉપર / ૬૦ વર્ષથી ઉપર -બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને ટેનિસ રમતમાં ત્રણ ઈવેન્ટમાંથી કોઈ પણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઈજ ગ્રૂપની સીધી જીન્નાસ્ટીક રમતમાં કોઈ પણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
- (૭) કોઈ પણ ખેલાડી માત્ર એક જ જિલ્લામાંથી કોઈ પણ એક જ રમતમાં અને એક જ વયજૂથમાં ભાગ લઈ શકશે.
- (૮) જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જ જિલ્લામાં નિવાસ / અભ્યાસ / વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
- (૯) શાળા/ગ્રામ્યકક્ષાએથી તાલુકાકક્ષા, તાલુકાકક્ષાએ થી જિલ્લાકક્ષા અને જિલ્લાકક્ષાએ થી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા વિજેતા ખેલાડીઓની એન્ટ્રી ઓનલાઈન મોકલી આપવાની રહેશે. ઓનલાઈન એન્ટ્રી વગર કોઈ પણ સ્પર્ધકને ઉપરની કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહિ.
- (૧૦) સ્પર્ધા દરમિયાન કોઈ પણ પ્રકારનો વિવાદ કે વાંધો હોય તો કોચ/વ્યાયામ શિક્ષકે લેખિતમાં રૂ. ૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પૂરા) ની પ્રોટેસ્ટ ફી સાથે અડધા કલાકની અંદર જિલ્લા આયોજન કમિટિ સમક્ષ રજૂ કરવાનો રહેશે. જિલ્લા આયોજન કમિટિનો નિર્ણય આખરી અને સર્વેને માન્ય અને બંધનકર્તા રહેશે.
- (૧૧) તમામ ખેલાડી/ટીમોએ તેઓના શિડયુલમાં નિયત થયેલ સમય/તારીખ મુજબના મેચ માટે ટુર્નામેન્ટના ચીફ રેફરી અથવા આસીસ્ટન્ટ ચીફ રેફરીને ૧૫ મિનિટ પહેલાં પોતે હાજર હોવાનો રીપોર્ટ કરવાનો રહેશે. તેમજ જે ખેલાડીઓ/ટીમો શિડયુલ મુજબ પોતે હાજર હોવાનો રીપોર્ટ નહિ કરે તો તેમની એન્ટ્રી રદ કરવામાં આવશે અને તેમની સામેના ખેલાડી/ટીમનો વિજેતા જાહેર કરવામાં આવશે.
- (૧૨) ટુર્નામેન્ટ દરમિયાન આકસ્મિક સંજોગો અનુસાર ટુર્નામેન્ટના શિડયુલ નિયત થયેલ સમય/તારીખ/સ્થળમાં ફેરફાર/બદલી કરવાની સત્તા ચીફ રેફરી/ટુર્નામેન્ટ કમિટીને રહેશે.
- (૧૩) શાળા/ગ્રામ્યમાંથી તાલુકા/ઝોનકક્ષાની સ્પર્ધામાં  
- વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.  
- ટીમ રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ ટીમો ખેલાડીઓ ભાગ લેશે.  
તાલુકા/ઝોનકક્ષામાંથી જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધામાં  
- વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.  
- ટીમ રમતમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવેલ ૨ ટીમો ભાગ લેશે.  
જિલ્લાકક્ષામાંથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વ્યક્તિગત રમતમાં પ્રથમ અને દ્વિતીય વિજેતા ખેલાડીઓ અને ટીમ રમતમાં માત્ર પસંદગી પામેલ એક જ ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

- (૧) ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ / નોકરી / વ્યવસાય / નિવાસ કરતો હોવા જોઈએ. જેના આધાર-પુરાવા-પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. (નોકરીયાતના કિસ્સામાં નિયમ-૧૭ લાગુ પાડવામાં આવશે.)
- (૨) સ્પર્ધાનીચે મુજબની વય મર્યાદામાં યોજવામાં આવશે. (A) ૯ વર્ષથી નીચે (B) ૧૧ વર્ષથી નીચે (C) ૧૪ વર્ષથી નીચે (D) ૧૭ વર્ષથી નીચે (E) ઓપન એઈજ (સિનિયર) ગ્રુપ (F) ૪૦ વર્ષથી ઉપરના, (G) ૬૦ વર્ષથી ઉપરના
- (૩) સ્પર્ધા જે તે રમતના ભારતના ફેડરેશન/એસોસીએશનના નિયમ મુજબ જ યોજવામાં આવશે.
- (૪) કોઈ પણ ખેલાડી તેની ખરેખર (ચેલેન્જ સિવાય) એક જ વયમર્યાદા (ગ્રુપ) / વજનગ્રુપમાં જ ભાગ લઈ શકશે.  
૧) અં. ૯, અં. ૧૧, અં. ૧૪, અં. ૧૭ વયજૂથના ખેલાડી તેનાથી ઉપરની વયજૂથમાં ભાગ લઈ શકશે. (કોઈ પણ એક જ વયજૂથ (ચેલેન્જ માટે)  
૨) ઓપન એઈજ ગ્રુપ (સિનિયર) ના ખેલાડીઓ પોતાની વયજૂથમાં જ ભાગ લઈ શકશે.  
૩) ૪૦ વર્ષથી ઉપરની વયજૂથના ખેલાડીઓ માત્ર તેમની વયજૂથમાં જ ભાગ લઈ શકશે.  
૪) ૬૦ વર્ષથી ઉપરની વયજૂથના ખેલાડીએ પોતાના વયજૂથ અથવા ૪૦ વર્ષથી ઉપરની વયજૂથની રમતોમાં ભાગ લઈ શકશે. (કોઈ પણ એક જ વયજૂથ (ચેલેન્જ માટે)
- (૫) એથ્લીટીક્સ રમતમાં વધુમાં વધુ બે વ્યક્તિગત અને એક રીલે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે (SGFI ના નિયમ મુજબ). એથ્લીટીક્સ :- જિલ્લાકક્ષાની સ્પર્ધામાં યોજાનાર વ્યક્તિગત ઈવેન્ટમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ખેલાડીઓને ૪×૧૦૦ મી. રીલે અને ૪×૪૦૦ મી. રીલેની એથ્લીટીક ટીમ બનાવવાની રહેશે જે રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.  
- સ્વીમિંગ રમતમાં વધુમાં વધુ ત્રણ ઈવેન્ટ અને બે રીલે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. સ્વીમિંગ :- જિલ્લાકક્ષાની સ્પર્ધામાં યોજાનાર વ્યક્તિગત ઈવેન્ટમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ખેલાડીઓને ૪×૧૦૦ મી. ફ્રી સ્ટાઈલ રીલે અને ૪×૧૦૦ મી. મીડલે, ૪×૪૦૦ ફ્રી સ્ટાઈલ રીલે ટીમ બનાવવાની રહેશે જે રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
- (૬) સ્કેટીંગમાં વધુમાં વધુ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. તેમજ ઓપન એઈજ / ૪૦ વર્ષથી ઉપર / ૬૦ વર્ષથી ઉપર - બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને ટેનિસ રમતમાં ત્રણ ઈવેન્ટમાંથી કોઈ પણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઈજ ગ્રુપની સીધી જીઆરસ્ટીક રમતમાં કોઈ પણ બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
- (૭) કોઈપણ ખેલાડી માત્ર એક જ જિલ્લામાંથી કોઈ પણ એક જ રમતમાં અને એક જ વયજૂથમાં ભાગ લઈ શકશે.
- (૮) જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જ જિલ્લામાં નિવાસ / અભ્યાસ / વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
- (૯) શાળા/ગ્રામ્યકક્ષાએથી તાલુકાકક્ષા, તાલુકાકક્ષાએ થી જિલ્લાકક્ષા અને જિલ્લાકક્ષાએ થી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા વિજેતા ખેલાડીઓની એન્ટ્રી ઓનલાઈન મોકલી આપવાની રહેશે. ઓનલાઈન એન્ટ્રી વગર કોઈપણ સ્પર્ધકને ઉપરની કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહિ.
- (૧૦) સ્પર્ધા દરમિયાન કોઈપણ પ્રકારનો વિવાદ કે વાંધો હોય તો કોચ/વ્યાયામ શિક્ષકે લેખિતમાં રૂ. ૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પૂરા) ની પ્રોટેસ્ટ ફી સાથે અડધા કલાકની અંદર જિલ્લા આયોજન કમિટિ સમક્ષ રજૂ કરવાનો રહેશે. જિલ્લા આયોજન કમિટિનો નિર્ણય આખરી અને સર્વેને માન્ય અને બંધનકર્તા રહેશે.
- (૧૧) તમામ ખેલાડી/ટીમોએ તેઓના શિડયુલમાં નિયત થયેલ સમય/તારીખ મુજબના મેચ માટે ટુર્નામેન્ટના ગીફ રેફરી અથવા આસીસ્ટન્ટ ચીફ રેફરીને ૧૫ મિનિટ પહેલાં પોતે હાજર હોવાનો રીપોર્ટ કરવાનો રહેશે. તેમજ જે ખેલાડીઓ/ટીમો શિડયુલ મુજબ પોતે હાજર હોવાનો રીપોર્ટ નહિ કરે તો તેમની એન્ટ્રી રદ કરવામાં આવશે અને તેમની સામેના ખેલાડી/ટીમનો વિજેતા જાહેર કરવામાં આવશે.
- (૧૨) ટુર્નામેન્ટ દરમિયાન આકસ્મિક સંજોગો અનુસાર ટુર્નામેન્ટના શિડયુલ નિયત થયેલ સમય/તારીખ/સ્થળમાં ફેરફાર/બદલી કરવાની સત્તા ચીફ રેફરી/ટુર્નામેન્ટ કમિટીને રહેશે.
- (૧૩) શાળા/ગ્રામ્યમાંથી તાલુકા/ઝોનકક્ષાની સ્પર્ધામાં  
- વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.  
- ટીમ રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ ટીમો ખેલાડીઓ ભાગ લેશે.  
તાલુકા/ઝોનકક્ષામાંથી જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધામાં  
- વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.  
- ટીમ રમતમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવેલ ૨ ટીમો ભાગ લેશે.  
જિલ્લાકક્ષામાંથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વ્યક્તિગત રમતમાં પ્રથમ અને દ્વિતીય વિજેતા ખેલાડીઓ અને ટીમ રમતમાં માત્ર પસંદગી પામેલ એક જ ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
- (૧૪) રાજ્યમાં તમામ રમતની સ્પર્ધાઓ શાળા/ગ્રામ્યકક્ષાથી જિલ્લા કક્ષા સુધીની સ્પર્ધાઓ એક જ સમયે / એક જ તારીખે રાખવામાં આવશે.
- (૧૫) કોઈપણ રમતના ક્વોલીફાઈડ કોચ/ટીમ સાથેના મેનેજર જે તે રમતની સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ.

**શાળાકક્ષાએ રમાનાર સ્પર્ધાનો કાર્યક્રમ (અન્ડર - ૯ / અન્ડર - ૧૧ )**

ક્રમ	રમતનું નામ	સ્પર્ધાની તારીખ	ઝોન કન્વીનરને પ્રવેશપત્ર મોકલવાની તારીખ	સ્થળ	આયોજક
૧.	એથ્લેટીક્સ અં.૯ માટે (દોડ ૩૦ મી.) અં.૧૧ માટે (દોડ ૫૦ મી.) સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮	જૂનાગઢ જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓ	આચાર્યશ્રી, જે તે પ્રાથમિક શાળા

**શાળાકક્ષાએ રમાનાર સ્પર્ધાનો કાર્યક્રમ (અન્ડર - ૧૪)**

ક્રમ	રમતનું નામ	સ્પર્ધાની તારીખ	ઝોન કન્વીનરને પ્રવેશપત્ર મોકલવાની તારીખ	સ્થળ	આયોજક
૧.	એથ્લેટીક્સ (દોડ ૧૦૦ મી.)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮	જૂનાગઢ જિલ્લાની	આચાર્યશ્રી,
૧.૨	એથ્લેટીક્સ (લાંબી કૂદ)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮	દરેક પ્રાથમિક શાળાઓ	જે તે પ્રાથમિક
૧.૩	એથ્લેટીક્સ (ગોળા ફેંક)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮		શાળા
૨	વોલીબોલ	૨૦-૯-૨૦૧૮	૨૧-૯-૨૦૧૮		
૩	ખો-ખો	૨૧-૯-૨૦૧૮	૨૨-૯-૨૦૧૮		

**શાળાકક્ષાએ રમાનાર સ્પર્ધાનો કાર્યક્રમ (અન્ડર - ૧૭)**

ક્રમ	રમતનું નામ	સ્પર્ધાની તારીખ	ઝોન કન્વીનરને પ્રવેશપત્ર મોકલવાની તારીખ	સ્થળ	આયોજક
૧.	એથ્લેટીક્સ (૧૦૦ મી. દોડ)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮	જૂનાગઢ જિલ્લાની	આચાર્યશ્રી,
૧.૨	એથ્લેટીક્સ (લાંબી કૂદ)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮	દરેક માધ્યમિક શાળાઓ	જે તે માધ્યમિક
૧.૩	એથ્લેટીક્સ (લંગડીફાળ કૂદ)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮		શાળા
૧.૪	એથ્લેટીક્સ (ગોળા ફેંક)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮		
૨	વોલીબોલ	૨૦-૯-૨૦૧૮	૨૧-૯-૨૦૧૮		
૩	ખો-ખો	૨૧-૯-૨૦૧૮	૨૨-૯-૨૦૧૮		
૪	રસ્સાખેંચ	૨૧-૯-૨૦૧૮	૨૨-૯-૨૦૧૮		

**શહેરકક્ષાએ રમાનાર સ્પર્ધાનો કાર્યક્રમ (ઓપન એઈજ)**

ક્રમ	રમતનું નામ	સ્પર્ધાની તારીખ	ઝોન કન્વીનરને પ્રવેશપત્ર મોકલવાની તારીખ	સ્થળ	આયોજક
૧	એથ્લેટીક્સ (૧૦૦ મી. દોડ)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮	જે તે વોર્ડની	આચાર્યશ્રી,
૧.૨	એથ્લેટીક્સ (લાંબી કૂદ)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮	પ્રાથમિક શાળા	જે તે પ્રાથમિક
૧.૩	એથ્લેટીક્સ (લંગડીફાળ કૂદ)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮		શાળા
૧.૪	એથ્લેટીક્સ (ગોળા ફેંક)	૧૯-૯-૨૦૧૮	૨૦-૯-૨૦૧૮		
૨	વોલીબોલ	૨૦-૯-૨૦૧૮	૨૧-૯-૨૦૧૮		
૩	ખો-ખો	૨૦-૯-૨૦૧૮	૨૧-૯-૨૦૧૮		
૪	રસ્સાખેંચ	૨૧-૯-૨૦૧૮	૨૨-૯-૨૦૧૮		
૫	કબડ્ડી	૨૧-૯-૨૦૧૮	૨૨-૯-૨૦૧૮		

**ઝોન કક્ષાએ રમાનાર સ્પર્ધાનો કાર્યક્રમ**

ક્રમ	રમતનું નામ	સ્પર્ધાની તારીખ	જિલ્લા કન્વીનરને પ્રવેશપત્ર મોકલવાની તારીખ
૧.	યોગાસન	૨૨-૯-૨૦૧૮	૨૩-૯-૨૦૧૮
૨.	ખો-ખો	૨૩-૯-૨૦૧૮	૨૪-૯-૨૦૧૮
૩.	રસ્સાખેંચ	૨૪-૯-૨૦૧૮	૨૫-૯-૨૦૧૮
૪.	કબડ્ડી	૨૫-૯-૨૦૧૮	૨૬-૯-૨૦૧૮
૫.	શર્ટીંગ બોલ	૨૬-૯-૨૦૧૮	૨૭-૯-૨૦૧૮
૬.	વોલીબોલ	૨૭-૯-૨૦૧૮	૨૮-૯-૨૦૧૮
૭.	ચેસ	૨૮-૯-૨૦૧૮	૨૯-૯-૨૦૧૮
૮.	એથ્લેટીક્સ	૨૯/૩૦-૯-૨૦૧૮	૩૦-૯-૨૦૧૮ / ૧-૧૦-૨૦૧૮

સૂચના: ૧. શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, રાજ્યકક્ષાથી શરૂ થતી રમતોની ઈવેન્ટ દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે.

૨. અં-૧૭ કબડ્ડી સ્પર્ધા ચાલુ વર્ષે અગાઉ આયોજન કરવાનું હોવાથી ખેલમહાકુળમાં મર્જ ગણાશે નહિ.

**गोनकक्षा स्पर्धा कार्यक्रम (अं.६, ११, १४, १७, ओपन ओर्थ, ४० वर्षीय उपर, ६० वर्षीय उपर  
गोन क्वीनर, स्पर्धा स्थान-तारीम दर्शवितुं पत्रक (स्पर्धा सवारे ८:३० क्लाके शर थरो)**

क्रम	गोन नुं नाम	आयोजक / सहक्वीनरनुं नाम आने मोलाईल नंभर	योगासन स्पर्धा तारीम	भोजो स्पर्धा तारीम	रस्साभेय स्पर्धा तारीम	कळडी स्पर्धा तारीम	शुटीगजोव स्पर्धा तारीम	वोलीजोव स्पर्धा तारीम	थेस स्पर्धा तारीम
१	ओन १	श्री सुलभा आर्य कन्या विद्यालय भा.मधोण काटक मो. ८४२७१ ८४८७०	श्री सुलभा आर्य कन्या विद्यालय भा.मधोण काटक	श्री सुलभा आर्य कन्या विद्यालय भा.मधोण काटक	श्री सुलभा आर्य कन्या विद्यालय भा.मधोण काटक	श्री सुलभा आर्य कन्या विद्यालय भा.मधोण काटक	श्री सुलभा आर्य कन्या विद्यालय भा.मधोण काटक	श्री सुलभा आर्य कन्या विद्यालय भा.मधोण काटक	श्री सुलभा आर्य कन्या विद्यालय भा.मधोण काटक
२	ओन २	श्री सिलनभाई लायाण्णी मो. ८०००६ ८८४८६	प्रकृतिधाम, लवनाथ तणेटी, जूनागढ	प्रकृतिधाम, लवनाथ तणेटी, जूनागढ	प्रकृतिधाम, लवनाथ तणेटी, जूनागढ	प्रकृतिधाम, लवनाथ तणेटी, जूनागढ	प्रकृतिधाम, लवनाथ तणेटी, जूनागढ	प्रकृतिधाम, लवनाथ तणेटी, जूनागढ	प्रकृतिधाम, लवनाथ तणेटी, जूनागढ
३	ओन ३	श्री ओविदभाई छैया मो. ८८२५६ ७७०२६	मीनराज शैक्षिक संकुल लवनाथ	मीनराज शैक्षिक संकुल लवनाथ	मीनराज शैक्षिक संकुल लवनाथ	मीनराज शैक्षिक संकुल लवनाथ	मीनराज शैक्षिक संकुल लवनाथ	मीनराज शैक्षिक संकुल लवनाथ	मीनराज शैक्षिक संकुल लवनाथ
४	ओन ४	श्री ईरिफानभाई गराणा ८८८८८ ७७७७७	शि.पं.स्पोर्ट्स संकुल गांधीचोक, जूनागढ	शि.पं.स्पोर्ट्स संकुल गांधीचोक, जूनागढ	शि.पं.स्पोर्ट्स संकुल गांधीचोक, जूनागढ	शि.पं.स्पोर्ट्स संकुल गांधीचोक, जूनागढ	शि.पं.स्पोर्ट्स संकुल गांधीचोक, जूनागढ	शि.पं.स्पोर्ट्स संकुल गांधीचोक, जूनागढ	शि.पं.स्पोर्ट्स संकुल गांधीचोक, जूनागढ
५	ओन ५	श्री रश्मिकभाई कनेरिया मो. ८४२७३ ८०६५३	श्रीमति आर.जे. कनेरिया ग.धा. मोतीबाग, जूनागढ	श्रीमति आर.जे. कनेरिया ग.धा. मोतीबाग, जूनागढ	श्रीमति आर.जे. कनेरिया ग.धा. मोतीबाग, जूनागढ	श्रीमति आर.जे. कनेरिया ग.धा. मोतीबाग, जूनागढ	श्रीमति आर.जे. कनेरिया ग.धा. मोतीबाग, जूनागढ	श्रीमति आर.जे. कनेरिया ग.धा. मोतीबाग, जूनागढ	श्रीमति आर.जे. कनेरिया ग.धा. मोतीबाग, जूनागढ
६	ओन ६	श्री विशाकभाई हवे मो. ८५१११ २३५३३	ओकलय पल्लीक स्कूल, ओजरडा राड, जूनागढ	ओकलय पल्लीक स्कूल, ओजरडा राड, जूनागढ	ओकलय पल्लीक स्कूल, ओजरडा राड, जूनागढ	ओकलय पल्लीक स्कूल, ओजरडा राड, जूनागढ	ओकलय पल्लीक स्कूल, ओजरडा राड, जूनागढ	ओकलय पल्लीक स्कूल, ओजरडा राड, जूनागढ	ओकलय पल्लीक स्कूल, ओजरडा राड, जूनागढ
७	ओन ७	श्री लसतभाई लेदारिया मो. ८८२५७ २८२३८	श्री ओन. पी. लावोरिया धाई. मोतीबाग, जूनागढ	श्री ओन. पी. लावोरिया धाई. मोतीबाग, जूनागढ	श्री ओन. पी. लावोरिया धाई. मोतीबाग, जूनागढ	श्री ओन. पी. लावोरिया धाई. मोतीबाग, जूनागढ	श्री ओन. पी. लावोरिया धाई. मोतीबाग, जूनागढ	श्री ओन. पी. लावोरिया धाई. मोतीबाग, जूनागढ	श्री ओन. पी. लावोरिया धाई. मोतीबाग, जूनागढ
८	ओन ८	श्री सेमतभाई बावडा मो. ८८२४४ ७४२२२	कामेल कोन्वेन्ट स्कूल गांधीग्राम, जूनागढ	कामेल कोन्वेन्ट स्कूल गांधीग्राम, जूनागढ	कामेल कोन्वेन्ट स्कूल गांधीग्राम, जूनागढ	कामेल कोन्वेन्ट स्कूल गांधीग्राम, जूनागढ	कामेल कोन्वेन्ट स्कूल गांधीग्राम, जूनागढ	कामेल कोन्वेन्ट स्कूल गांधीग्राम, जूनागढ	कामेल कोन्वेन्ट स्कूल गांधीग्राम, जूनागढ

**गोन कक्षा ओर्थेटीक स्पर्धा कार्यक्रम (अं.६, अं.११, अं.१७, ओपन ओर्थ (भाईसो/भाईनो))**

वारीम	समय		स्थान	
	वारीम	समय	वारीम	समय
२८/०८/१८	सवारे ८:०० क्लाके	ओन १	श्री स्वामी विवेकानंद रिनय मंदिर	ओन ५
२९/०८/१८	सवारे ८:०० क्लाके	ओन २	स्पोर्ट्स कोम्प्लेक्स, कणवाचोक	ओन ६
२९/०८/१८	अपारे ३:०० क्लाके	ओन ३	कणवाचोक	ओन ७
२९/०८/१८	अपारे ३:०० क्लाके	ओन ४		ओन ८

**सूचना :** शाणु/ओनकक्षा, शिळाकक्षा, राजपडकाथी थरु थती रमतोनी ठीवे-ट दर्शावतुं पत्रक आ सांथे सोमेल छी.

ओनकवीनर A. जेवाडीओन १) ओनवाठीम अन्दी २) जन्मने पुरावो ३) निवासने पुरावो करजियातपत्रे लेवाना रेशे.

B. परिषाम कर्छव, अडेवाळ कर्छव (कोटोशाक/विडीयो (सी.डी.)), डिसाणी कर्छव सांथे स्पर्धा पूर्ण थये डिन-३ मां शिळा रमतगमत अधिकारीनी कवेरीमां जमा कराववाना रेशे.

**જિલ્લાકક્ષા સ્પર્ધા કાર્યક્રમ (અં.૯, ૧૧, ૧૪, ૧૭, ઓપન એઈજ, ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર)**  
જિલ્લા સહકર્મીનર, સ્પર્ધા સ્થળ-તારીખ દર્શાવતું પત્રક (સ્પર્ધા સવારે ૯:૦૦ કલાકે શરૂ થશે)

ક્રમ	રમતનું નામ	આયોજક/સહકર્મીનરનું નામ અને સંપર્ક નંબર	સ્પર્ધા સ્થળ	અં.૯ ભા / ગ	અં.૧૧ ભા / ગ	અં.૧૪ ભા / ગ	અં.૧૭ ભા / ગ	ઓપન એઈજ ભા / ગ	૪૦ થી ઉપર (ભા./ગ.)	૬૦ થી ઉપર (ભા./ગ.)
૧	ફૂટબોલ	શ્રી ઈરફાનભાઈ ગરાણા ૯૮૯૮૮ ૩૭૩૭૫	શ્રી જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ સંકુલ ગાંધીચોક, જૂનાગઢ	×	×	×	×	૧૯/૯/૧૮	×	×
૨	હોકી	શ્રી દર્શનભાઈ વાઘેલા ૯૫૫૮૮ ૧૬૯૬૬	શ્રી સ્વામિનારાયણ જ્ઞાનભાગ ગુરુકુળ, સાબલપુર ચોકડી પાસે, જૂનાગઢ	×	×	×	×	૧૯/૯/૧૮	×	×
૩	બાસ્કેટબોલ	શ્રી રસિકભાઈ કનેરિયા ૯૪૨૭૩ ૮૦૬૫૩	શ્રીમતિ આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈ., મોતીબાગ, જૂનાગઢ	×	×	×	×	૨૦/૯/૧૮	×	×
૪	ટેકવેન્ડો	શ્રી ભરતભાઈ ભેટારિયા ૯૮૨૫૭ ૨૮૨૩૯	શ્રી એન. પી. ભાલોડિયા હાઈ., મોતીબાગ, જૂનાગઢ	×	×	×	×	૨૧/૯/૧૮	×	×
૫	સ્ટેટીંગ	શ્રી દર્શનભાઈ વાઘેલા ૯૫૫૮૮ ૧૬૯૬૬	શ્રી સ્વામિનારાયણ જ્ઞાનભાગ ગુરુકુળ, સાબલપુર ચોકડી પાસે, જૂનાગઢ	×	×	×	×	૨૩/૯/૧૮	×	×
૬	હેન્ડબોલ (બહેનો)	શ્રી આનંદભાઈ રાણીયા ૯૯૭૯૨ ૪૬૦૮૨	શ્રીમતિ આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈ., મોતીબાગ, જૂનાગઢ	×	×	×	×	૨૩/૯/૧૮	×	×
૭	ટેબલ ટેનિસ	શ્રી હેમતભાઈ ચાવડા ૯૯૨૪૪ ૩૪૨૨૨	કાર્મલ કોન્વેન્ટ સ્કૂલ, ગાંધીગ્રામ જૂનાગઢ	×	×	×	×	૨૪/૯/૧૮	×	×
૮	કુસ્તી	શ્રી ઈરફાનભાઈ ગરાણા ૯૮૯૮૮ ૩૭૩૭૫	શ્રી જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ સંકુલ ગાંધીચોક, જૂનાગઢ	×	×	×	×	૨૫/૯/૧૮	૨૫/૯/૧૮	૨૫/૯/૧૮
૯	તીરંદાજી (આર્ચરી)	શ્રી ભરતભાઈ ભેટારિયા ૯૮૨૫૭ ૨૮૨૩૯	શ્રી એન. પી. ભાલોડિયા હાઈ. મોતીબાગ, જૂનાગઢ	×	×	×	×	૨૬/૯/૧૮	×	×
૧૦	લોન ટેનિસ	શ્રી ઈરફાનભાઈ ગરાણા ૯૮૯૮૮ ૩૭૩૭૫	શ્રી એન. પી. ભાલોડિયા હાઈ. મોતીબાગ, જૂનાગઢ	×	×	×	×	૨૬/૯/૧૮	૨૬/૯/૧૮	૨૬/૯/૧૮
૧૧	શૂટીંગ બોલ (ભાઈઓ)	શ્રી વસંતભાઈ મધુડિયા ૯૪૨૭૧ ૮૪૯૭૦	શ્રી સુભાષ આર્પ કન્યા વિદ્યાલય ખામધોળ ફાટક પાસે, જૂનાગઢ	×	×	×	×	૨૭/૯/૧૮	૨૭/૯/૧૮	૨૭/૯/૧૮
૧૨	સ્વીમીંગ	શ્રી ભરતભાઈ ભેટારિયા ૯૮૨૫૭ ૨૮૨૩૯	શ્રી એન. પી. ભાલોડિયા હાઈ. મોતીબાગ, જૂનાગઢ	×	×	×	×	૨૮/૯/૧૮	૨૮/૯/૧૮	૨૮/૯/૧૮

**જિલ્લાકક્ષા સ્પર્ધા કાર્યક્રમ (અં.૯, ૧૧, ૧૪, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર)**  
જિલ્લા સહકર્મીનર, સ્પર્ધા સ્થળ-તારીખ દર્શાવતું પત્રક (સ્પર્ધા સવારે ૯:૦૦ કલાકે શરૂ થશે)

ક્રમ	રમતનું નામ	આયોજક/સહકર્મીનરનું નામ અને સંપર્ક નંબર	સ્પર્ધા સ્થળ	અં.૯ ભા / ઠ	અં.૧૧ ભા / ઠ	અં.૧૪ ભા / ઠ	અં.૧૭ ભા / ઠ	ઓપન એઈજ ભા / ઠ	૪૦ થી ઉપર ભા. / ઠ.	૬૦ થી ઉપર ભા. / ઠ.
૧૩	ચેસ	શ્રી દિલીપભાઈ પરમાર ૯૭૨૬૭ ૭૧૩૧૭	શ્રી સ્વામિનારાયણ અક્ષર મંદિર, પ્રેમવતી હોલ મોતીબાગ, જૂનાગઢ	X	૨/૧૦/૧૮	૨/૧૦/૧૮	૨/૧૦/૧૮	૨/૧૦/૧૮	૨/૧૦/૧૮	૨/૧૦/૧૮
૧૪	એથેલીટીસ (ભાઈઓ)	શ્રી ઈસ્કાનભાઈ ગરાણા મો. ૯૮૯૮૮ ૩૭૩૭૫	જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીચોક, જૂનાગઢ	૩/૧૦/૧૮	૩/૧૦/૧૮	૩/૧૦/૧૮	૩/૧૦/૧૮	૩/૧૦/૧૮	X	X
	એથેલીટીસ (બહેનો)	શ્રી ઈસ્કાનભાઈ ગરાણા મો. ૯૮૯૮૮ ૩૭૩૭૫	જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીચોક, જૂનાગઢ	૪/૧૦/૧૮	૪/૧૦/૧૮	૪/૧૦/૧૮	૪/૧૦/૧૮	૪/૧૦/૧૮	X	X
૧૫	વોલીબોલ	શ્રી કેતનભાઈ જાગણી ૯૪૨૬૧ ૮૪૦૯૫	શ્રી પટેલ કલ્પજી મંડળ અપર પ્રાયમરી ગર્લ્સ સ્કૂલ, મોતીબાગ, જૂનાગઢ	X	X	૪/૧૦/૧૮	૪/૧૦/૧૮	૪/૧૦/૧૮	X	X
૧૬	કબડી	શ્રી હેમતભાઈ ચાવડા ૯૯૨૪૪ ૩૪૨૨૨	કાર્મલ કોન્વેન્ટ સ્કૂલ, ગાંધીગ્રામ, જૂનાગઢ	X	X	૪/૧૦/૧૮	૪/૧૦/૧૮	૪/૧૦/૧૮	X	X
૧૭	રસ્સાખેંચ	શ્રી પ્રતીકભાઈ વ્યાસ ૯૭૩૪૮ ૩૦૦૦૫ ૯૦૯૯૯ ૭૨૦૪૭	શ્રી સ્વામિનારાયણ જ્ઞાનભાગ ગુરુકુળ સાબલપુર ચોકડી પાસે, જૂનાગઢ	X	X	X	૫/૧૦/૧૮	૫/૧૦/૧૮	૫/૧૦/૧૮	૫/૧૦/૧૮
૧૮	જુડો (ભાઈઓ)	શ્રી ભરતભાઈ ભેટારિયા ૯૮૨૫૭ ૨૮૨૩૯	શ્રી એન. પી. ભાલોરિયા ઇાઈ. મોતીબાગ, જૂનાગઢ	X	X	૫/૧૦/૧૮	૫/૧૦/૧૮	૫/૧૦/૧૮	X	X
	જુડો (બહેનો)	શ્રી આનંદભાઈ રાણીયા ૯૯૭૯૨ ૪૬૦૮૨	શ્રીમતિ આર. જે. કનેરિયા ગર્લ્સ ઇાઈ., મોતીબાગ, જૂનાગઢ	X	X	૬/૧૦/૧૮	૬/૧૦/૧૮	૬/૧૦/૧૮	X	X
૧૯	બેડમિન્ટન	શ્રી કાજલબેન ડેર ૭૩૫૯૮ ૭૮૫૦૭	શ્રીમતિ આર. એસ. કાલરિયા અંગ્રેજી માધ્યમ સ્કૂલ, મોતીબાગ, જૂનાગઢ	X	X	૬/૧૦/૧૮	૬/૧૦/૧૮	૬/૧૦/૧૮	૬/૧૦/૧૮	૬/૧૦/૧૮
૨૦	બો-બો	શ્રી વસંતભાઈ મધુરિયા ૯૪૨૭૧ ૮૪૯૭૦	શ્રી સુભાષ આર્મ કન્યા વિદ્યાલય ખામધોળ કાંટક પાસે, જૂનાગઢ	X	X	૬/૧૦/૧૮	૬/૧૦/૧૮	૬/૧૦/૧૮	X	X
૨૧	ચોગાસન	શ્રી દિલીપભાઈ પરમાર ૯૭૨૬૭ ૭૧૩૧૭	શ્રી સ્વામિનારાયણ જ્ઞાનભાગ ગુરુકુળ, સાબલપુર ચોકડી પાસે, જૂનાગઢ	X	X	૭/૧૦/૧૮	૭/૧૦/૧૮	૭/૧૦/૧૮	X	X

સૂચના : જિલ્લાકર્મીનરે A. ખેલાડીઓના ૧) ઓનલાઈન એન્ટ્રી/ઓનની એન્ટ્રી ૨) જન્મનો પુરાવો ૩) નિવાસનો પુરાવો ફરજિયાતપણે લેવાના રહેશે.

B. પ્રથમ/દ્વિતીય/ત્રીતીય વિજેતા ખેલાડીઓના રોકડ પુરસ્કારના ફોર્મ સાથે જે તે ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી જોડવાની રહેશે. (આર ટીમ/ખેલાડી ભાગ લીધેલ હોય તો જ રોકડ પુરસ્કારનું ફોર્મ ભરવું.)

C. જિલ્લાના વિજેતા ખેલાડીઓના પરિણામ જિલ્લા કોમ્પ્યુટર ઓપરેટર પાસે ઓનલાઈન વિનીંગ મોડ્યુલમાં અપડેટ કરાવવાના રહેશે.

D. રોકડ પુરસ્કારના ફોર્મ-ફાઈલ, પરિણામ ફાઈલ, અહેવાલ ફાઈલ (સેલોગ્રાફ/વિડીયો (સી.ડી.)), હિસાબી ફાઈલ સાથે સ્પર્ધા પૂર્ણ થયે દિન-૩ માં જિલ્લા રમતગમત અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.



# રાજ્યકક્ષા ખેલ મહાકુંભ - ૨૦૧૮

એલીજબીલીટી - સર્ટીફિકેટ  
(રાજ્યકક્ષાની સ્પર્ધામાં જતા પહેલા ભરવાનું ફોર્મ)  
જિલ્લાનું નામ : જૂનાગઢ શહેર

વય ગ્રુપ	
રમતનું નામ	
ઈવેન્ટસ	

ખેલાડીનો  
પાસપોર્ટ  
સાઈઝનો  
ફોટો  
(ફોટા પર શાળા  
/સંસ્થા/સરપંચનો  
સિક્કો લગાવવો)

- (૧) KMKI.D.No.  ટીમ આઈ.ડી. નં.:
- (૨) ખેલાડીનું પૂરું નામ:  જાતિ:  પુરુષ / સ્ત્રી
- અટક નામ પિતાનું નામ
- (૩) જન્મ તારીખ:  ધોરણ:  મોબાઈલ નં.:
- (૪) તાલુકો:  જિલ્લો:
- (૫) ખેલાડીનું ઘરનું સરનામું:
- (૬) શાળા/મહાશાળા/સંસ્થાનું નામ:
- (૭) જાતી:  ( એસ.સી. / એસ.ટી. / ઓ.બી.સી. / અન્ય )

## બાહેધરી

આથી હું  નીચે મુજબની

બાહેધરી આપું છું કે,

- (૧) હું આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શારીરિક સક્ષમ છું. તેમજ સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક ઈજા/અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે.
- (૨) મેં સમગ્ર રાજ્યમાં ફક્ત એક જ જિલ્લાના સ્થળેથી એક જ રમતમાં ભાગ લેવા ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે. આમાં કોઈ પણ જાતનો વાંધો જણાય તો મારી ઉમેદવારી રદ (બાતલ) ગણાશે.
- (૩) હું ખેલ મહાકુંભ-૨૦૧૮ ની રમતની સ્પર્ધામાં પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ જે તે સ્પર્ધા સ્થળે આયોજન સંસ્થાનો સંપર્ક કરી સમય પહેલા ઉપસ્થિત રહીશ.
- (૪) સ્પર્ધા સ્થળ પર જન્મનો પુરાવો તથા નિવાસનો પુરાવો સાથે ઉપસ્થિત રહીશ.

ખેલાડીની સહી:

મેનેજરનું નામ:  નંબર:

મેનેજરની સહી:

શાળા/સંસ્થાના વડાના/સરપંચ/ચીફ ઓફીસરના સહિ/સિક્કા

જિલ્લા રમતગમત અધિકારી,  
જૂનાગઢ શહેર

નોંધ: SGFIની રમતો પૈકીની અં. ૧૪ અને અં. ૧૭ રમતો (૧.એથેલીટીકસ, ૨.વેસ, ૩.સ્વીમિંગ, ૪.વોલીબોલ, ૫.બોબો, ૬.કબડ્ડી (અં. ૧૭ સિવાય), ૭.મોગાસન, ૮.આર્ચરી, ૯.સ્કેટીંગ, ૧૦.જુડો, ૧૧.કુસ્તી, ૧૨.ટેકવેન્ડો, ૧૩.બેડમિન્ટન, ૧૪.બાસ્કેટબોલ, ૧૫.ટેબલટેનિસ, ૧૬.બોનટેનિસ, ૧૭.હૅન્ડબોલ, ૧૮.હોકી, ૧૯.ફુટબોલ, ૨૦.રસ્સાપંચ) નો ખેલમહાકુંભમાં સમાવેશ થયેલ તમામ રમતો માટે સ્કૂલ એમ્ડ એલીજબીલીટી અને ખેલમહાકુંભનું એલીજબીલીટી બંને ભરવાનું રહેશે.

# Certificate of Eligibility for School

FORMAT

State / UT / UNIT .....

20\_\_ TO 20\_\_

Under the aegis of School Games Federation of India

## Certificate of Eligibility

Age Group Under \_\_\_\_\_ Boy / Girls

Latest Photo name  
with date duly  
Attested by the  
principal Head  
Master with  
Stamp

1.	Name of the participant (In Block Letters)	
2.	Father's Name (In Block Letters)	
3.	Mother's Name (In Block Letters)	
4.	Name Of the School (In Block Letters)	
5.	Full Address of School (In Block Letters)	
6.	School's Phone No. with Code No.	
7.	Date of Birth (i) In Fig. (ii) In Words	<input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/>
8.	Discipline (inform to game name)	
9.	Passport No.	
10.	Age in Completed years as on 31st December	Year <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> Month <input type="text"/> <input type="text"/> Days <input type="text"/> <input type="text"/>
11.	Permanent Address with Phone / Mob. No. (In Block Letters)	
12.	Admission No. & Year	
13.	Date of Joining the School	
14.	Standard & Section Studying this year	
15.	Standard Studying last year	
16.	Bank Details of Participant (If no then mention Mother/Father A/C No.)	Name :
		Name of Bank :
		A/C No. :
		IFSC Code :
17.	Personal Identification Marks	1.
		2.
18.	Aadhar Card No.	
19.	Last year Registration No. of SGFI	
20.	Signature of the Participant	

**Certificate :**

1. Certified that the above participant is a bonafide student of this institution for the academic year.
2. Certified that I have personally verified the admission records, maintained in the school and found correct.
3. Certificate that it is understood in the event of information furnished above found to be partly or wholly untrue, the above student is liable to be disqualified for a period of two years in case the student is a member of the team, then the participant is liable to be disqualified as a whole.

Signature of Competent Authority  
of State / UT / Unit, with seal

Signature with seal  
Manager / Coach  
Post / Desn. \_\_\_\_\_

Signature with seal of the  
Head of Institute / Principal /  
Head Master

For Office Use Only

Name of Invigilator .....

Sign of Invigilator .....



## ખેલ મહાકુંભ - ૨૦૧૮

### જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવાપાત્ર રોકડ પુરસ્કાર

ક્ર. મ.	કક્ષા	વિજેતા ક્રમ	વયજૂથ							
			અં.૯/૧૧		અં.૧૪		અં.૧૭		ઓપન, અબઉ ૪૦/૬૦	
			વ્યક્તિગત	વ્યક્તિગત	સાંધિક	વ્યક્તિગત	સાંધિક	વ્યક્તિગત	સાંધિક	
૧	જિલ્લા કક્ષા	પ્રથમ	૩૦૦૦	૩૦૦૦	૧૫૦૦	૫૦૦૦	૩૦૦૦	૫૦૦૦	૩૦૦૦	
		દ્વિતીય	૨૦૦૦	૨૦૦૦	૧૦૦૦	૩૦૦૦	૨૦૦૦	૩૦૦૦	૨૦૦૦	
		તૃતીય	૧૦૦૦	૧૦૦૦	૭૫૦	૨૦૦૦	૧૦૦૦	૨૦૦૦	૧૦૦૦	
૨	રાજ્ય કક્ષા	પ્રથમ	૫૦૦૦	૫૦૦૦	૩૦૦૦	૧૦૦૦૦	૫૦૦૦	૧૦૦૦૦	૫૦૦૦	
		દ્વિતીય	૩૦૦૦	૩૦૦૦	૨૦૦૦	૭૦૦૦	૩૦૦૦	૭૦૦૦	૩૦૦૦	
		તૃતીય	૨૦૦૦	૨૦૦૦	૧૦૦૦	૫૦૦૦	૨૦૦૦	૫૦૦૦	૨૦૦૦	

નોંધ : વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર વિતરણ DBT દ્વારા જે તે ખેલાડીના ખાતામાં તબદીલ (RTGS) કરવાના રહેશે. વિજેતા ખેલાડી/ટીમે રોકડ પુરસ્કાર ફોર્મ કેન્સલ ચેક, આધાર કાર્ડ સાથે સ્પર્ધા સમયે અથવા દિન-૭ માં આયોજક/ક-વીનરને ફરજિયાત જમા કરવાનું રહેશે.

### રાજ્યકક્ષા વિજેતા કોચને રાજ્યકક્ષાએ ચૂકવવાપાત્ર રોકડ પુરસ્કાર

ક્ર. મ.	કક્ષા	વિજેતા ક્રમ	વયજૂથ							
			અં.૯/૧૧		અં.૧૪		અં.૧૭		ઓપન	
			વ્યક્તિગત	વ્યક્તિગત	સાંધિક	વ્યક્તિગત	સાંધિક	વ્યક્તિગત	સાંધિક	
૧	રાજ્ય કક્ષા	પ્રથમ	૧૫૦૦	૧૫૦૦	૧૦૦૦	૧૫૦૦	૧૦૦૦	૧૫૦૦	૧૦૦૦	
		દ્વિતીય	૧૨૦૦	૧૨૦૦	૭૫૦	૧૨૦૦	૭૫૦	૧૨૦૦	૭૫૦	
		તૃતીય	૯૦૦	૯૦૦	૫૦૦	૯૦૦	૫૦૦	૯૦૦	૫૦૦	

નોંધ : રાજ્યકક્ષાની સ્પર્ધામાં અં.-૯, ૧૧, ૧૪, ૧૭ અને ઓપન એજ (સિનિયર) વિજેતા થયેલ ખેલાડીઓના કોચને DBT દ્વારા રોકડ પુરસ્કાર આપવાનો રહેશે. ગિલ્લી-દંડાના કોચને રોકડ પુરસ્કાર આપવાનો રહેશે નહિ. રાજ્યકક્ષાની સ્પર્ધામાં અબઉ-૪૦ અને ૬૦ વયજૂથના વિજેતા થયેલ ખેલાડીઓના કોચને રોકડ પુરસ્કાર આપવાનો રહેશે નહિ. રજીસ્ટ્રેશન ફોર્મમાં કોચનું નામ હોય તો જ રોકડ પુરસ્કાર મળવાપાત્ર થશે. રજીસ્ટ્રેશન ફોર્મમાં દરશવિલ કોચનું નામ ઉમેરી બદલી શકાશે નહિ.

### શ્રેષ્ઠ શાળાને ચૂકવવાપાત્ર રોકડ પુરસ્કાર

વિજેતા ક્રમ	ઝોન કક્ષા	જિલ્લા કક્ષા	રાજ્ય કક્ષા
પ્રથમ	૨૫૦૦૦	૧૫૦૦૦૦	૫૦૦૦૦૦
દ્વિતીય	૧૫૦૦૦	૧૦૦૦૦૦	૩૦૦૦૦૦
તૃતીય	૧૦૦૦૦	૭૫૦૦૦	૨૦૦૦૦૦

નોંધ : જિલ્લાકક્ષાએ હવે ફક્ત DLSS (ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) સિવાયની ત્રણ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવાની રહેશે. રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં DLSS (ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) ની ત્રણ શ્રેષ્ઠ શાળાઓ અને DLSS (ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) સિવાયની અન્ય ત્રણ શ્રેષ્ઠ શાળાઓની એમ રાજ્યકક્ષાએ કુલ ૬ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરી રોકડ પુરસ્કાર સ્વરૂપે અનુદાન આપી સન્માનિત કરાશે.

**ખેલમહાકુંભ - ૨૦૧૮**

**ખેલાડી રોકડ પુરસ્કાર ફોર્મ**

(ફોર્મ ફરજિયાત અંગ્રેજી કેપીટલ લેટરમાં ભરવાનું રહેશે.)

બધી જ વિગતો ભરવી ફરજિયાત છે.



ખેલાડીની વિગત											
ખેલાડીનું કે.એમ.કે. આઈ.ડી.											
ખેલાડીનું નામ	નામ										
(અંગ્રેજીમાં)	પિતાનું નામ										
	અટક										
ખેલાડીનું ઘરનું પૂરેપૂરું સરનામું											
અંગ્રેજીમાં											
										પીન કોડ નંબર	
કોચનું નામ (અંગ્રેજીમાં)											
કોર્પોરેશન / જિલ્લા કક્ષા <input type="checkbox"/> રાજ્ય કક્ષા <input type="checkbox"/>											
વય જૂથ	<input type="checkbox"/> ભાઈઓ	<input type="checkbox"/> U9	<input type="checkbox"/> U11	<input type="checkbox"/> U14	<input type="checkbox"/> U17	<input type="checkbox"/> OPEN AGE CATEGORY					
	<input type="checkbox"/> બહેનો	<input type="checkbox"/> A40	<input type="checkbox"/> A60								
રમત											
ઈવેન્ટનું નામ											
મોબાઈલ નં.-૧											
મોબાઈલ નં.-૨											
ઈ-મેઈલ આઈ.ડી.											
આધાર કાર્ડ નંબર											
બેન્ક ખાતાની વિગત : રોકડ પુરસ્કાર ખાતામાં જમા											
ખાતેદારનું નામ											
એકાઉન્ટ નંબર											
બેન્કનું નામ											
બ્રાંચનું નામ											
આઈ.એફ.એસ.સી. કોડ											
કેન્સલ ચેક આપેલ છે કે નહિ									હા	ના	
ચેકની પાછળ વિગત આપવી, નામ, KMK ID, મોબાઈલ નંબર									હા	ના	

હું ખાતરી આપું છું કે ઉપર જણાવેલ વિગતો સાચી છે. મારા દ્વારા જણાવેલ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા વિનંતી.

નોંધ : રાજ્યકક્ષાની સ્પર્ધામાં એબાઉ-૪૦ અને ૬૦ વયજૂથના વિજેતા થયેલા ખેલાડીઓના કોચને રોકડ પુરસ્કાર આપવાનો રહેશે. નહિ.

(ખેલાડીની સહી)

ઓર્ગેનાઈઝર/કન્વીનર દ્વારા ભરવાની વિગત			
કોર્પોરેશન/જિલ્લાકક્ષા <input type="checkbox"/> રાજ્યકક્ષા <input type="checkbox"/>			
રમત			
ઈવેન્ટનું નામ			
વિજેતા ક્રમાંક	પ્રથમ <input type="checkbox"/>	દ્વિતીય <input type="checkbox"/>	તૃતીય <input type="checkbox"/>
ઈ-નામ મેળવવા પાત્ર રકમ રૂ.			
કન્વીનરનું નામ	હોદ્દો	સહી	



# પેલમહાકુંલ-૨૦૧૮ (૨મતોની યાદી)

જ રમતમાં ભાગ લેવાનો હેતુ તેની સામે  કરવી

સીધી સાબી કસાયી શરૂ થતી સ્પર્ધા

એલેટીકસ  ૩૦ મીટર  સેન્ટીમીટર ૪૫૫

જ રમતમાં ભાગ લેવાનો હેતુ તેની સામે  કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી સાબી કસાયી શરૂ થતી સ્પર્ધા

એલેટીકસ  ૫૦ મીટર  સેન્ટીમીટર ૪૫૫

દેસ

સીધી જિલ્લા/કોર્પોરેશન કસાયી શરૂ થતી સ્પર્ધા

સ્લીમીંગ  ૧૦૦ મીટર કી સ્પર્ધા

સ્લીમીંગ  અનિતિગત મીટર (૨૦૦ મીટર)

એલેટીકસ (૧.૧.૨૦૦૫ થી ૩૧.૧૨.૨૦૦૭ દરમિયાન)

સીધી સાબી કસાયી શરૂ થતી સ્પર્ધા

એલેટીકસ  ૧૦૦ મીટર  ૧૦૦ મીટર  ૧૦૦ મીટર

વોલીબોલ

બો-બો

કબડી  સાઈડ (૧૫ કિગ્રા)  બહેનો (૪૮ કિગ્રા)

સીધી સાબી કસાયી શરૂ થતી સ્પર્ધા

એલેટીકસ  ૨૦૦ મીટર  ૪૦૦ મીટર  ૬૦૦ મીટર  ૮૦૦ મીટર  ૧૦૦૦ મીટર

દેસ

બોલમન  અનિતિગત બોલ (અનિતિગત બોલ (૩, ૫, ૭, ૯ અને ૧૦ મીટરની ખાસતી))

સીધી જિલ્લા/કોર્પોરેશન કસાયી શરૂ થતી સ્પર્ધા

બોલમન  આર્થિક બોલ (ફિલ્ડ મેન)  રિપાબ્લિક બોલ (બોલ- બોલમનનો ખેલકોડ બદલ વધુમાં વધુ ર ઉલ્લેખમાં લાગ લઈ શકશે.)

આઈસી  હાઈસ્ક્રીમ-૨ (અનિતિગત બોલમન)

સ્લીમીંગ  ૧૦૦ મી. કી સ્પર્ધા  ૧૦૦ મી. કી સ્પર્ધા  ૧૦૦ મી. કી સ્પર્ધા  ૧૦૦ મી. કી સ્પર્ધા

સ્પોર્ટ્સ

ક્રોસ  ૧૦૦ મી. કી સ્પર્ધા  ૨૦૦ મી. કી સ્પર્ધા  ૩૦૦ મી. કી સ્પર્ધા  ૪૦૦ મી. કી સ્પર્ધા

અનિતિગત  ૧૦૦ મી. કી સ્પર્ધા  ૨૦૦ મી. કી સ્પર્ધા  ૩૦૦ મી. કી સ્પર્ધા  ૪૦૦ મી. કી સ્પર્ધા

કુર્ચી

ભાઈઓ  ૨૫ કિગ્રા સુધી  ૨૫-૩૦ કિગ્રા  ૩૦-૩૫ કિગ્રા  ૩૫-૪૦ કિગ્રા

બહેનો  ૨૩ કિગ્રા સુધી  ૨૩-૨૮ કિગ્રા  ૨૮-૩૩ કિગ્રા  ૩૩-૩૮ કિગ્રા

કુર્ચી

ભાઈઓ  ૩૬ કિગ્રા સુધી  ૩૬-૪૧ કિગ્રા  ૪૧-૪૬ કિગ્રા  ૪૬-૫૧ કિગ્રા

બહેનો  ૩૦ કિગ્રા સુધી  ૩૦-૩૫ કિગ્રા  ૩૫-૪૦ કિગ્રા  ૪૦-૪૫ કિગ્રા

ટેકવેન્ડો

ભાઈઓ  ૧૦ કિગ્રા સુધી  ૧૦-૧૫ કિગ્રા  ૧૫-૨૦ કિગ્રા  ૨૦-૨૫ કિગ્રા

બહેનો  ૧૬ કિગ્રા સુધી  ૧૬-૨૦ કિગ્રા  ૨૦-૨૪ કિગ્રા  ૨૪-૨૮ કિગ્રા

વેસ્ટવેસ્ટન  સિંગલ

અસ્ટેડબોલ

ટેબલ ટેનિસ  સિંગલ

હોન ટેનિસ  સિંગલ

ફેનબોલ

તીકી

ફુટબોલ

સીધી સાબી કસાયી શરૂ થતી સ્પર્ધા

એલેટીકસ  ૮૦ મી. ફાઈલ  ૪ x ૧૦૦ મી. રીલ

સ્લીમીંગ  ૩૧ કિગ્રા સુધી  ૩૧-૩૬ કિગ્રા  ૩૬-૪૧ કિગ્રા  ૪૧-૪૬ કિગ્રા  ૪૬-૫૧ કિગ્રા

સ્પોર્ટ્સ

ક્રોસ  ૧૦૦ મી. કી સ્પર્ધા  ૨૦૦ મી. કી સ્પર્ધા  ૩૦૦ મી. કી સ્પર્ધા  ૪૦૦ મી. કી સ્પર્ધા

અનિતિગત  ૧૦૦ મી. કી સ્પર્ધા  ૨૦૦ મી. કી સ્પર્ધા  ૩૦૦ મી. કી સ્પર્ધા  ૪૦૦ મી. કી સ્પર્ધા

કુર્ચી

ભાઈઓ  ૪૦-૪૫ કિગ્રા  ૪૫-૫૦ કિગ્રા  ૫૦ કિગ્રા થી ઉપર

બહેનો  ૩૬-૪૦ કિગ્રા  ૪૦-૪૪ કિગ્રા  ૪૪ કિગ્રા થી ઉપર

કુર્ચી

ભાઈઓ  ૪૫-૪૫ કિગ્રા  ૪૫-૪૬ કિગ્રા  ૪૬-૫૧ કિગ્રા  ૫૧-૬૦ કિગ્રા

બહેનો  ૩૮-૪૧ કિગ્રા  ૪૧-૪૪ કિગ્રા  ૪૪-૪૮ કિગ્રા  ૪૮-૫૧ કિગ્રા

ટેકવેન્ડો

ભાઈઓ  ૨૧-૨૩ કિગ્રા  ૨૫-૨૭ કિગ્રા  ૨૭-૩૧ કિગ્રા  ૩૧-૩૫ કિગ્રા  ૩૫-૩૯ કિગ્રા  ૪૦-૪૪ કિગ્રા  ૪૪-૪૮ કિગ્રા  ૪૮-૫૨ કિગ્રા

બહેનો  ૧૬-૧૮ કિગ્રા  ૨૦-૨૨ કિગ્રા  ૨૩-૨૬ કિગ્રા  ૨૬-૨૯ કિગ્રા  ૨૯-૩૨ કિગ્રા  ૩૨-૩૫ કિગ્રા  ૩૫-૩૮ કિગ્રા

જીમાસ્ટીક

ભાઈઓ  ફ્લોર બેસબોલ  વોલબોલ  વોલેસીટાબોલ  અનિતિગત  સ્પા (રિપાબ્લિક)  ક્લબ (રિપાબ્લિક)  બોલ (રિપાબ્લિક)  રિપા (રિપાબ્લિક)

આઈસી

રિફલ સાઈફ  અનિતિગત બોલમન  અનિતિગત બોલમન સાઈફ  રીમ  મીસ રીમ

શુટિંગ

૧૦ મી. મેટર  ૧૦ મી. મેટર સાઈફ  ૧૦ મી. મેટર સાઈફ  ૧૦ મી. મેટર સાઈફ  ૧૦ મી. મેટર સાઈફ

કેસ્ટીંગ

કોલ  ડબ્બી  સેલર

બોલમન

ભાઈઓ  ૨૦-૨૦ કિગ્રા  ૩૦-૩૦ કિગ્રા  ૪૦-૪૦ કિગ્રા  ૫૦-૫૦ કિગ્રા  ૬૦-૬૦ કિગ્રા  ૭૦-૭૦ કિગ્રા  ૮૦-૮૦ કિગ્રા  ૯૦-૯૦ કિગ્રા  ૧૦૦-૧૦૦ કિગ્રા

બહેનો  ૨૦ કિગ્રા સુધી  ૨૦-૨૫ કિગ્રા  ૨૫-૩૦ કિગ્રા  ૩૦-૩૫ કિગ્રા  ૩૫-૪૦ કિગ્રા  ૪૦-૪૫ કિગ્રા  ૪૫-૫૦ કિગ્રા  ૫૦-૫૫ કિગ્રા  ૫૫-૬૦ કિગ્રા  ૬૦ કિગ્રા થી ઉપર

મલમલમ

રોપ મલમલમ (ફક્ત બહેનો)  પોલ મલમલમ (ફક્ત બહેનો)

સ્પોર્ટ ક્લબમીંગ

લોક ક્લબમીંગ  સ્પોર્ટ ક્લબમીંગ  વોલ રોપ

જાન્યૂઆરી ૨૦૧૮

- જુદા પાંચમી સ્પર્ધામાં ભાગ લેવાનાર, પહેલાં સ્પર્ધામાં ભાગ લેવાનાર પુસ્તકમાં ભાગ લેવાનાર
- જુદા પુસ્તકમાં ભાગ લેવાનાર, જુદા પાંચમી સ્પર્ધામાં ભાગ લેવાનાર, પહેલાં સ્પર્ધામાં ભાગ લેવાનાર
- જુદા પાંચમી સ્પર્ધામાં ભાગ લેવાનાર, પહેલાં સ્પર્ધામાં ભાગ લેવાનાર, પહેલાં સ્પર્ધામાં ભાગ લેવાનાર

નોંધ- સાબી કસાયી શરૂ થતી સ્પર્ધા માટે

- વોલમન રમતમાં ભાગ લેવાનાર અનિતિગત ઉલ્લેખ અને સીધી જિલ્લા/કોર્પોરેશન આર્થિક બોલ (ફિલ્ડ મેન) રિપાબ્લિક બોલ (બોલ- બોલમનનો ખેલકોડ બદલ વધુમાં વધુ ર ઉલ્લેખમાં લાગ લઈ શકશે.)
- વોલમન રમતમાં ભાગ લેવાનાર અનિતિગત ઉલ્લેખ અને સીધી જિલ્લા/કોર્પોરેશન આર્થિક બોલ (ફિલ્ડ મેન) રિપાબ્લિક બોલ (બોલ- બોલમનનો ખેલકોડ બદલ વધુમાં વધુ ર ઉલ્લેખમાં લાગ લઈ શકશે.)
- સ્લીમીંગ રમતમાં ભાગ લેવાનાર અનિતિગત ઉલ્લેખ અને સીધી જિલ્લા/કોર્પોરેશન આર્થિક બોલ (ફિલ્ડ મેન) રિપાબ્લિક બોલ (બોલ- બોલમનનો ખેલકોડ બદલ વધુમાં વધુ ર ઉલ્લેખમાં લાગ લઈ શકશે.)
- કુર્ચી ટેકવેન્ડો, બોલમન, ક્રોસ અને કુર્ચી રમતમાં કોઈ પણ એક વર્ગનું ગુપ્તમાં ભાગ લઈ શકશે.
- કુર્ચી ટેકવેન્ડો, અને કુર્ચી રમતમાં કોઈ પણ એક વર્ગનું ગુપ્તમાં ભાગ લઈ શકશે.

જુદા પાંચમી સ્પર્ધામાં ભાગ લેવાનાર, પહેલાં સ્પર્ધામાં ભાગ લેવાનાર, પહેલાં સ્પર્ધામાં ભાગ લેવાનાર



# ખેલમહાકુંલ-૨૦૧૮ (૨મતોની યાદી)

૨૦૨૨-૧૯ (૧.૧.૨૦૦૨ થી ૩.૧.૨૦૦૪ દરમિયાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ✓ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

## સીધી ક્લાસમાં ઉત્તરણી શરૂ થતી રમતો

થેબેટીસ	<input type="checkbox"/> ૧૦૦ મી.	<input type="checkbox"/> બંધીદ	<input type="checkbox"/> લંગડોશન ક્લ	<input type="checkbox"/> ગોગરેક
રમસાંગ	<input type="checkbox"/> ભાઈનો ૪૦૦ કિગ્રા	<input type="checkbox"/> બરેનો ૪૦૦ કિગ્રા	નોંધ: (૯ ખેલકોનો કુલ વજન)	
વોલિબોલ	<input type="checkbox"/>			
વોન્ને	<input type="checkbox"/>			
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈનો ૫૦ કિગ્રા	<input type="checkbox"/> બંધનો ૫૦ કિગ્રા		

## સીધી તાલકાળની ક્લાસમાં શરૂ થતી રમતો

થેબેટીસ	<input type="checkbox"/> ૨૦૦ મી.	<input type="checkbox"/> ૪૦૦ મી.	<input type="checkbox"/> ૬૦૦ મી.	<input type="checkbox"/> ૧૫૦૦ મી.	<input type="checkbox"/> ઉર્ધ્વકો	<input type="checkbox"/> બરડીકો	<input type="checkbox"/> પકડેર
થેક	<input type="checkbox"/>						
યોગ્યતા	<input type="checkbox"/> અભિનવ ભોજા યુવિજનભાગ (ગુપ્ત, મ. ટ અને મનાવલંકીના આસને)						

- નોંધ-વધુમાં વધુ,
- ગુપ્ત પુસ્તકોમાંથી કુલિયાન અને અન્ય અભિનવ ભોજાના પુસ્તકો વાંચવાનું ઉપદેશ આપવામાં આવેલું છે.
  - ગુપ્ત પુસ્તકોમાંથી કુલિયાન પુસ્તકોની કોપીઓ અભિનવ ભોજાના કોમ્પ્યુટર પરથી ઉતારવામાં આવેલી છે.
  - ગુપ્ત પુસ્તકોમાંથી કુલિયાન, કોઈ કુલિયાન ગેમિંગ સિસ્ટમના, પદો અભિનવ ભોજાના કોમ્પ્યુટર પરથી ઉતારવામાં આવેલા છે.

## સીધી વિદ્યાર્થીઓના ક્લાસમાં શરૂ થતી રમતો

આરંભ	<input type="checkbox"/> શુભિચ્છાન શરૂઆત (અભિનવ ભોજાના કોમ્પ્યુટર પરથી)	
યોગ્યતા	<input type="checkbox"/> આર્થિક વેગ (દુર્ગમલા)	<input type="checkbox"/> વિનયી વેગ
સીધી	<input type="checkbox"/> ૧૦૦ મી. ડી. સ્પીડ	<input type="checkbox"/> ૧૦૦ મી. ડી. સ્પીડ
સંઘી	<input type="checkbox"/> ૧૦૦ મી. ડી. સ્પીડ	<input type="checkbox"/> ૨૦૦ મી. ડી. સ્પીડ
કુડી	<input type="checkbox"/> ૧૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૨૦-૨૫ કિગ્રા
કુસ્તી	<input type="checkbox"/> ૨૨ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા
ટેકવોન્ડો	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ	
બાસ્કેટબોલ	<input type="checkbox"/>	
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ	
લીન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ	
ટેનિસ	<input type="checkbox"/>	
શેષી	<input type="checkbox"/>	
કુટબોલ	<input type="checkbox"/>	

- નોંધ- આજ ક્લાસમાં રમવાના વખતે
- યોગ્યતા રમતમાં લાગુ ક્લાસની અભિનવ ભોજાના કોમ્પ્યુટર પરથી ઉતારવામાં આવેલી છે.
  - કુલિયાનમાંથી કોઈ પણ એક ક્લાસમાં ભાગ લઈ શકશે.
  - થેબેટીસ રમતમાં વધુ માં વધુ ૩ ઈવેન્ટ અને ૧ સીટ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
  - કુસ્તી રમતમાં વધુ માં વધુ ૩ ઈવેન્ટ અને ૨ સીટમાં ભાગ લઈ શકશે.
  - સંઘીના વખતમાં વધુ ૩ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
  - કુસ્તી, ટેકવોન્ડો, બેડમીન્ટ, કુરલ અને કુડીની રમતમાં કોઈ પણ એક વખતમાં ભાગ લઈ શકશે.

## સીધી રાજ્ય ક્લાસમાં શરૂ થતી રમતો

થેબેટીસ	<input type="checkbox"/> ૩૦૦૦ મી.	<input type="checkbox"/> ૧૦૦ મી. ફીલ્ડ	<input type="checkbox"/> ૪ x ૧૦૦ મી. રીલે	<input type="checkbox"/> વાગહટ	<input type="checkbox"/> ફોલો કેર	<input type="checkbox"/> ૫ સી. મી. લેન (આઈ. ઓ. ઓ.)	<input type="checkbox"/> ૩ સી. મી. લેન (બંધનો)
આરંભ	<input type="checkbox"/> શુભિચ્છાન શરૂઆત	<input type="checkbox"/> શેક સ્પીડ ૧૦૦ મી.	<input type="checkbox"/> શેક સ્પીડ ૧૦૦ મી.	<input type="checkbox"/> બરડીકો ૨૦૦ મી.	<input type="checkbox"/> શી સ્પીડ ૨૦૦ મી. (આઈ. ઓ. ઓ.)	<input type="checkbox"/>	
સંઘી	<input type="checkbox"/> ૧૦૦ મી. ડી. સ્પીડ	<input type="checkbox"/>					
કુડી	<input type="checkbox"/> ૧૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૨૦-૨૫ કિગ્રા	<input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા	<input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા	<input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા	<input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા	<input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા
કુસ્તી	<input type="checkbox"/> ૨૨ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા	<input type="checkbox"/> ૨૫-૨૬ કિગ્રા	<input type="checkbox"/> ૨૬-૨૮ કિગ્રા	<input type="checkbox"/> ૨૯-૩૦ કિગ્રા	<input type="checkbox"/> ૩૧-૩૨ કિગ્રા	<input type="checkbox"/> ૩૩-૩૪ કિગ્રા
ટેકવોન્ડો	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા	<input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા	<input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા	<input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા	<input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા	<input type="checkbox"/> ૬૧-૬૫ કિગ્રા
કાન. સ્પીક	<input type="checkbox"/> ફ્લોર વેગ	<input type="checkbox"/> વોલિબોલ	<input type="checkbox"/> સોલન ટેબલ	<input type="checkbox"/> પેરાલેલ બાર	<input type="checkbox"/> ઓલિમ્પિક	<input type="checkbox"/> કોરેજીટલબાર	<input type="checkbox"/>
આરંભ	<input type="checkbox"/> સીધા રીડિંગ	<input type="checkbox"/> અભિનવ ભોજાના કોમ્પ્યુટર પરથી	<input type="checkbox"/> અભિનવ ભોજાના કોમ્પ્યુટર પરથી	<input type="checkbox"/> રીડિંગ	<input type="checkbox"/> મીડિયમ રીડિંગ	<input type="checkbox"/>	<input type="checkbox"/>
સંઘી	<input type="checkbox"/> ૧૦ મી. સેન્ટી મીટર	<input type="checkbox"/> ૧૦ મી. સેન્ટી મીટર	<input type="checkbox"/> ૧૦ મી. સેન્ટી મીટર	<input type="checkbox"/> ૧૦ મી. સેન્ટી મીટર	<input type="checkbox"/> ૧૦ મી. સેન્ટી મીટર	<input type="checkbox"/>	<input type="checkbox"/>
વેલોસિટી	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૫૫ કિગ્રા	<input type="checkbox"/> ૬૦ કિગ્રા	<input type="checkbox"/> ૬૫ કિગ્રા	<input type="checkbox"/> ૭૦ કિગ્રા	<input type="checkbox"/> ૭૫ કિગ્રા	<input type="checkbox"/> ૮૦ કિગ્રા થી ઉપર
કેન્સી	<input type="checkbox"/>						
બેડમીન્ટ	<input type="checkbox"/> ૨૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૨૦-૨૫ કિગ્રા	<input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા	<input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા	<input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા	<input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા	<input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા
કુડી	<input type="checkbox"/> ૨૨ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા	<input type="checkbox"/> ૨૫-૨૬ કિગ્રા	<input type="checkbox"/> ૨૬-૨૮ કિગ્રા	<input type="checkbox"/> ૨૯-૩૦ કિગ્રા	<input type="checkbox"/> ૩૧-૩૨ કિગ્રા	<input type="checkbox"/> ૩૩-૩૪ કિગ્રા
મલમલ	<input type="checkbox"/>						
ગોલ્ડ ટેનીસ	<input type="checkbox"/>						
સ્પોર્ટ ક્લબમાં	<input type="checkbox"/>						
રમી કુટબોલ	<input type="checkbox"/>						

- નોંધ- આજ ક્લાસમાં રમવાના વખતે
- યોગ્યતા રમતમાં લાગુ ક્લાસની અભિનવ ભોજાના કોમ્પ્યુટર પરથી ઉતારવામાં આવેલી છે.
  - કુલિયાનમાંથી કોઈ પણ એક ક્લાસમાં ભાગ લઈ શકશે.
  - થેબેટીસ રમતમાં વધુ માં વધુ ૩ ઈવેન્ટ અને ૨ સીટમાં ભાગ લઈ શકશે.
  - કુસ્તી રમતમાં વધુ માં વધુ ૩ ઈવેન્ટ અને ૨ સીટમાં ભાગ લઈ શકશે.
  - સંઘીના વખતમાં વધુ ૩ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
  - કુસ્તી, ટેકવોન્ડો, બેડમીન્ટ, કુરલ અને કુડીની રમતમાં કોઈ પણ એક વખતમાં ભાગ લઈ શકશે.



# બેલમહાકુલ-૨૦૧૮ (૨મતોની યાદી)

આપણે એક જ ગણ સિદ્ધિ (૨૫) ૧૦૧.૦૧.૧૯૭૯ થી ૧૨.૨૦૦૧ (૨) થી આજ સુધી

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ✓ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકો.)

શીર્ષી રમત ફાઈવોર્ડ વડે રમવાની સ્પર્ધા

એથેલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીદુર <input type="checkbox"/> લાંબીદુર ૬૬ <input type="checkbox"/> ગોળાકેડ	નોંધ-એથેલેટીક્સ > એથેલેટીક્સ રમતમાં વધુ મેં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકો. > સ્વૈચ્છિક રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકો. > સ્કેટીંગ વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકો. > ફુલ-ટી, ટેકવોલોન્ટ, બોક્સિંગ, કાર્ટે અને જુડો રમતમાં ગ્રેડ પણ એક વજન જુખમાં ભાગ લઈ શકો. > વેડબોલ, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી ગ્રેડ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકો.
રસ્સાબંધ	<input type="checkbox"/> ભાઈઓ ૫૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૨૦ કિગ્રા	
વોલીબોલ	<input type="checkbox"/>	
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૮૦ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૭૦ કિગ્રા)	
ખો-ખો	<input type="checkbox"/>	

શીર્ષી તીરણાં એથેલેટીક્સ અને વોલીબોલ

ફુટબોલ	<input type="checkbox"/> ૬૬૫ લાઇબ્રે માર્ડે
એથેલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ૫મીકેડ <input type="checkbox"/> બરછીકેડ <input type="checkbox"/> ચકકેડ
યેસ	<input type="checkbox"/>
ચોગમન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગ્ય યોમિયલશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના વ્યક્તિ)

શીર્ષી બિલ્ડઅપ/બોક્સિંગ અને વોલીબોલ

બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
ચોગમન	<input type="checkbox"/> ઓલિમ્પિક યોગ્ય(ફિટનેસ) <input type="checkbox"/> રિપબ્લિક યોગ્ય (નોંધ- ચોગમનમાં બેલારી ઘર, વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકો.)
ફુટબોલ	<input type="checkbox"/>
બાસ્કેટબોલ	<input type="checkbox"/>

ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
ટેન્નિસ	<input type="checkbox"/>
હોકી	<input type="checkbox"/>
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૨૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૪૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૮૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૧૫૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૩૦૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૫૦૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૧૦૦૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૪૦૦ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૨૦૦ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૧૦૦ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૨૫ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૧૦ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૫ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૨ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૧ મી. બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦૦ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૨૦૦ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૧૦૦ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૨૫ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૧૦ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૨ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૧ મી. બ્રસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦૦ મી. બટ્લેટ <input type="checkbox"/> ૨૦૦ મી. બટ્લેટ <input type="checkbox"/> ૧૦૦ મી. બટ્લેટ <input type="checkbox"/> ૫૦ મી. બટ્લેટ <input type="checkbox"/> ૨૫ મી. બટ્લેટ <input type="checkbox"/> ૧૦ મી. બટ્લેટ <input type="checkbox"/> ૫ મી. બટ્લેટ <input type="checkbox"/> ૨ મી. બટ્લેટ <input type="checkbox"/> ૧ મી. બટ્લેટ <input type="checkbox"/> ૫૦૦ મી. વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
રોકેટીંગ	ક્રોક્ડ <input type="checkbox"/> સીક ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> સીક ૩ (૧૦૦૦ મી.) ઇન લાઈન <input type="checkbox"/> સીક ૫ (૫૦૦ મી.) <input type="checkbox"/> સીક ૬ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૨ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૮-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા
ફુલ	ભાઈઓ <input type="checkbox"/> ૪૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૨-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૦ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૮-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૦ કિગ્રા
ટેકવોન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૦ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા
આનંદ	<input type="checkbox"/> ઇન્ડિયન ચેસ (વ્યક્તિગત યોગ્ય/બોલ)

શીર્ષી રમત ફાઈવોર્ડ અને વોલીબોલ

એથેલેટીક્સ	<input type="checkbox"/> ૫૦૦૦-ની <input type="checkbox"/> ૧૫૦ મી. હાઈલેન્ડ <input type="checkbox"/> ૧૦૦ મી. હાઈલેન્ડ(બહેનો) <input type="checkbox"/> ૪૦૦મી. હાઈલેન્ડ <input type="checkbox"/> ૨૫ ૧૦૦૦મી. રીલે <input type="checkbox"/> ૪ x ૪૦૦ મી. રીલે <input type="checkbox"/> વોસ્ટફ <input type="checkbox"/> હાઈલેન્ડ કેડ
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૫૦ મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૮૦૦મી બહેનો <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૧૫૦૦ મી ભાઈઓ <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ રીલે ૨x ૧૦૦મી. <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી. <input type="checkbox"/> બટ્લેટ ૫૦૦ મી <input type="checkbox"/> બટ્લેટ ૨૦૦ મી <input type="checkbox"/> બટ્લેટ ૧૦૦ મી <input type="checkbox"/> બટ્લેટ ૫૦ મી <input type="checkbox"/> બટ્લેટ ૨૫ મી <input type="checkbox"/> બટ્લેટ ૧૦ મી <input type="checkbox"/> બટ્લેટ ૫ મી <input type="checkbox"/> બટ્લેટ ૨ મી <input type="checkbox"/> બટ્લેટ ૧ મી <input type="checkbox"/> બટ્લેટ ૫૦૦ મી. વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૬૫-૬૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર બહેનો <input type="checkbox"/> ૪૮-૪૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા
ફુલ	ભાઈઓ <input type="checkbox"/> ૪૨-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૮-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા
ટેકવોન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર બહેનો <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૮૦ કિગ્રા
આનંદ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ સીક ૨ કેડ <input type="checkbox"/> વ્યક્તિગત યોગ્ય/બોલ <input type="checkbox"/> વ્યક્તિગત ઓલિમ્પિકન સાર્કીસ <input type="checkbox"/> સીપ <input type="checkbox"/> ગ્રીસ સીપ ડબલ્સ સાર્કીસ <input type="checkbox"/> વ્યક્તિગત ઓલિમ્પિકન <input type="checkbox"/> વ્યક્તિગત ઓલિમ્પિકન સાર્કીસ <input type="checkbox"/> સીપ <input type="checkbox"/> ગ્રીસ સીપ
ક્રીડાસૈદ્ધિક	ભાઈઓ <input type="checkbox"/> ફુલ-ટી યોગ્ય/બોલ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમ્બોઇડ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમોલોજી <input type="checkbox"/> હાઈબાર બહેનો <input type="checkbox"/> ફુલ-ટી યોગ્ય/બોલ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> મેલોસોલોજી <input type="checkbox"/> અન ઇવન્યુઅર
આર્થોસ્ટીક સ્ટ્રેટીજી	<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ઓલિમ્પિક <input type="checkbox"/> ફીગર

> જુડો/ક્રીડાસૈદ્ધિક સ્પર્ધામાં બેલારી ઘર પછા એ ઇવેન્ટમાં ભાગ લઈ શકો.

સાઈકલિંગ	<input type="checkbox"/> ૨૦ કી.મી.
શુર્ટિંગ	સાઈફલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. મી.ન. ભાઈ યેર સાયફલ <input type="checkbox"/> ૫૦ મી. ૦.૨૨ સાઈફલ ૩ ગોરિંગ પિસ્તોલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. ૦.૧૦૩ યેર પિસ્તોલ <input type="checkbox"/> ૨૫ મી. ૦.૧૨ રેપીડ ફાયર (ભાઈઓ) <input type="checkbox"/> ૨૫ મી. ૦.૨૨ સ્પોર્ટિંગ પિસ્તોલ (બહેનો) ટ્રેપ ગ્રુપ <input type="checkbox"/> ઓલિમ્પિક ડબલ ટ્રેપ <input type="checkbox"/> ઓલિમ્પિક ડબલ ટ્રેપ

વેઈટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૬૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૫ કિગ્રા <input type="checkbox"/> ૧૦૫ કિગ્રા <input type="checkbox"/> ૧૨૫ કિગ્રાથી ઉપર બહેનો <input type="checkbox"/> ૫૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩ કિગ્રા <input type="checkbox"/> ૭૫ કિગ્રા <input type="checkbox"/> ૯૫ કિગ્રાથી ઉપર	> શુર્ટિંગ સ્પર્ધામાં સ્વૈચ્છિક શુર્ટિંગ માટે ગોલ્ડની સર્કલ લાગવાની રહેશે. અગ્રવર્ધી ગોલ્ડ પાઠ એ ઇવેન્ટમાં ભાગ લઈ શકો. > બ્રુડી જ સ્પર્ધાઓ ઈન્ટર નેશનલ શુર્ટિંગ સ્પોર્ટિસ ફેડરેશન(ISSF)ના બેલારી ઘરમાં મુજબ ઘોળશે.
કન્સ્ટ્રીક્ટ	<input type="checkbox"/> કોર્સ <input type="checkbox"/> ડાબે <input type="checkbox"/> સેવર	
બોક્સિંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૨૦ કિગ્રા <input type="checkbox"/> ૨૦-૧૫ કિગ્રા <input type="checkbox"/> ૧૫-૧૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦-૬ કિગ્રા <input type="checkbox"/> ૬-૬ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૨૦ કિગ્રા <input type="checkbox"/> ૨૦-૧૫ કિગ્રા <input type="checkbox"/> ૧૫-૧૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦-૬ કિગ્રા <input type="checkbox"/> ૬-૬ કિગ્રા	
ગરદે	ભાઈઓ <input type="checkbox"/> ૭૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦-૧૧૦ કિગ્રા <input type="checkbox"/> ૧૧૦-૧૨૦ કિગ્રા <input type="checkbox"/> ૧૨૦-૧૩૦ કિગ્રા <input type="checkbox"/> ૧૩૦-૧૪૦ કિગ્રા <input type="checkbox"/> ૧૪૦-૧૫૦ કિગ્રા <input type="checkbox"/> ૧૫૦-૧૬૦ કિગ્રા <input type="checkbox"/> ૧૬૦-૧૭૦ કિગ્રા <input type="checkbox"/> ૧૭૦-૧૮૦ કિગ્રા <input type="checkbox"/> ૧૮૦-૧૯૦ કિગ્રા <input type="checkbox"/> ૧૯૦-૨૦૦ કિગ્રા <input type="checkbox"/> ૨૦૦-૨૧૦ કિગ્રા <input type="checkbox"/> ૨૧૦-૨૨૦ કિગ્રા <input type="checkbox"/> ૨૨૦-૨૩૦ કિગ્રા <input type="checkbox"/> ૨૩૦-૨૪૦ કિગ્રા <input type="checkbox"/> ૨૪૦-૨૫૦ કિગ્રા <input type="checkbox"/> ૨૫૦-૨૬૦ કિગ્રા <input type="checkbox"/> ૨૬૦-૨૭૦ કિગ્રા <input type="checkbox"/> ૨૭૦-૨૮૦ કિગ્રા <input type="checkbox"/> ૨૮૦-૨૯૦ કિગ્રા <input type="checkbox"/> ૨૯૦-૩૦૦ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૭૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૭૨-૭૬ કિગ્રા <input type="checkbox"/> ૭૬-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૮૪ કિગ્રા <input type="checkbox"/> ૮૪-૮૮ કિગ્રા <input type="checkbox"/> ૮૮-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૯૬ કિગ્રા <input type="checkbox"/> ૯૬-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦-૧૦૪ કિગ્રા <input type="checkbox"/> ૧૦૪-૧૦૮ કિગ્રા <input type="checkbox"/> ૧૦૮-૧૧૨ કિગ્રા <input type="checkbox"/> ૧૧૨-૧૧૬ કિગ્રા <input type="checkbox"/> ૧૧૬-૧૨૦ કિગ્રા <input type="checkbox"/> ૧૨૦-૧૨૪ કિગ્રા <input type="checkbox"/> ૧૨૪-૧૨૮ કિગ્રા <input type="checkbox"/> ૧૨૮-૧૩૨ કિગ્રા <input type="checkbox"/> ૧૩૨-૧૩૬ કિગ્રા <input type="checkbox"/> ૧૩૬-૧૪૦ કિગ્રા <input type="checkbox"/> ૧૪૦-૧૪૪ કિગ્રા <input type="checkbox"/> ૧૪૪-૧૪૮ કિગ્રા <input type="checkbox"/> ૧૪૮-૧૫૨ કિગ્રા <input type="checkbox"/> ૧૫૨-૧૫૬ કિગ્રા <input type="checkbox"/> ૧૫૬-૧૬૦ કિગ્રા <input type="checkbox"/> ૧૬૦-૧૬૪ કિગ્રા <input type="checkbox"/> ૧૬૪-૧૬૮ કિગ્રા <input type="checkbox"/> ૧૬૮-૧૭૨ કિગ્રા <input type="checkbox"/> ૧૭૨-૧૭૬ કિગ્રા <input type="checkbox"/> ૧૭૬-૧૮૦ કિગ્રા <input type="checkbox"/> ૧૮૦-૧૮૪ કિગ્રા <input type="checkbox"/> ૧૮૪-૧૮૮ કિગ્રા <input type="checkbox"/> ૧૮૮-૧૯૨ કિગ્રા <input type="checkbox"/> ૧૯૨-૧૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૯૬-૨૦૦ કિગ્રા	
મલખમ	<input type="checkbox"/> રોપ મલખમ (૬૬૫ બહેનો) <input type="checkbox"/> બેલ મલખમ (૬૬૫ ભાઈઓ)	
સ્પોર્ટ ક્લાઇમીંગ	<input type="checkbox"/> લીડ ક્લાઇમીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લાઇમીંગ <input type="checkbox"/> બોલ ક્લાઇમીંગ	
સ્વની ફુટબોલ	<input type="checkbox"/>	
સોફ્ટ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ	